

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૦૩/૨૦૧૮ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૨૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૫ કેસ કરી, ૫૧ વ્યક્તિઓને ઝડપી, ૧૬૦ લીટર દેશી દારૂ, ૨૩૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૬૬ બિયર ટીન, ૧ મોટર સાયકલ અને ૨ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૮ વ્યક્તિને ઝડપી રોકડ રૂપિયા ૭૩૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૨૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૫૨૮/૧૮

**કાગડાપીઠ:** જયશ્રીબહેન વા/ઓ ચંદ્રસિંહ પરમાર (રહે. શાકમાર્કેટની સામેની શેરી દયાનંદ ચોક ટંકારા જીલ્લો-મોરબી) એ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૩/૧૮ કલાક ૧૨/૪૫ વાગ્યાના સુમારે ગીતામંદિર નવા બસસ્ટેશન પ્લેટફોર્મ નંબર-૧ ઉપર વડોદરાથી મોરબી બસની સાજલીમાંથી અજાણી વ્યક્તિ જયશ્રીબહેન પરમારની બેગ ચોરી કરી લઈ ગઈ હતી. જે બેગમાં સોનાના હાર નંગ-૨, સોનાનો પંજો, સોનાના પાટલા નંગ-૨ અને સોનાની બુટ્ટી-૧ કિંમત રૂપિયા ૯૮,૦૦૦/- મતા હતી. આ ગુનાની તપાસ હે.કો.શ્રી જીતેન્દ્રભાઈ સમરસિંહ ચલાવે છે.

**રખિયાલ:** દિલીપકુમાર શાંતીલાલ જૈન ઉવ૪૫ રહે.૪૦૨ આદિત્ય ફ્લેટ લક્ષ્મીનારાયણ સો.સા (ઉસ્માનપુર) એ તા.૧૬/૦૩/૧૮ નારોજ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે રખિયાલ કેવલકાંઠા એસ્ટેટ રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં આવેલ નીરવાના મેટલ્સ નામની પોતાની દુકાનમાં કામ કરતો આરોપી સંદિપ જશરાજ કોઠારી (રહે. ઋષભ એકન્યુ જૈન દૈરાસર પાસે ઓઢવ) તા.૧૪/૦૩/૧૮ કલાક ૧૨/૦૦ થી ૧/૦૦ વાગ્યા દરમિયાનમાં દુકાનમાંથી રોકડ રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- અને એકટીવા નંબર જીજે ૦૧ જેવી ૬૩૬૩ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.પી.ભેટરીયા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૫૨૯/૧૮

સરખેજ: શૈલેષભાઈ સ/ઓ કેશાભાઈ રાવળ (રહે.રાવળવાસ પોસ્ટ ઓફીસ રોડ સરખેજ) એ તા.૦૭/૦૪/૧૭ રાતના ૧૦/૩૦ વાગે સરખેજ યાગોદર રોડ એક્તા હોટલની સામે ભારત પેટ્રોલીયમની પાછળ અશોક લેલન કંપનીની પોતાની ટ્રક નંબર જીજે ૧૨ એટી ૯૬૭૫ કિમત રૂપિયા ૯,૨૫,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૦૮/૦૪/૧૭ સવારના ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ શૈલેષભાઈ રાવળે તા.૧૬/૦૩/૧૮ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.સી.મકવાણા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૫૩૦/૧૮

શહેરકોટડા: હીમાલીબહેન વા/ઓ જૈમીનભાઈ પટેલ (ઉ.વ.૨૩) (રહે.શ્રી હરી એવન્યુ શ્રીનાથ પાર્ટી પ્લોટ સામે નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૫/૦૩/૧૮ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે સરસપુર નાની સાળવી વાડ ખાતે પોતાના નાના-નાનીના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે શરદાબેન હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.પો.કમિ. શ્રી ડી ડીવિઝન ચલાવે છે.

નારોલ: ભાવનાબહેન ડો/ઓ રમેશભાઈ પરમાર (ઉ.વ.૨૦) (રહે. શ્રીરામ રેસીડેન્સી નારોલ) એ અગમ્ય કારણસર તા.૧૬/૦૩/૧૮ બપોરના ૪/૪૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે દવાની ગોળી ખાઈ લેતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી ઝેડ.આઈ.શેખ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અવાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.